

**LL.B. Semester - 4 (CBCS) Examination**  
**April/May -2022 [NEW COURSE]**  
**Company Law(Core)**

Time: 2:30 Hours

Marks: 70

**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- 
- પ્રશ્ન-૧ કંપનીની વ્યાખ્યા આપો. અને કંપનીની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. (૧૪)  
 અથવા
- પ્રશ્ન-૧ કંપનીના જુદાજુદા પ્રકારોની ચર્ચા કરો.
- પ્રશ્ન-૨ આવેદન પત્રક એટલે શું? ઉદ્દેશ્યની કલમના સુધારણા સંબંધિત નિયમોને સમજાવો. (૧૪)  
 અથવા
- પ્રશ્ન-૨ કંપની એક્ટ -૨૦૧૩ માં આપેલ કંપનીના નિયમન પત્રમાં ફેરબદલની પ્રક્રિયા સમજાવો.
- પ્રશ્ન-૩ કંપનીના પ્રોત્સાહક કોને કહેવાય? પ્રોત્સાહક જે કંપની પ્રમોટ કરે છે તેમાં તેનું કાયદુકીય સ્થાન શું છે તેની ચર્ચા કરો. (૧૪)  
 અથવા
- પ્રશ્ન-૩ વિજ્ઞાપન પત્ર શું છે? વિજ્ઞાપન પત્રમાં અસત્ય નિવેદનો બદલ શેર ધારકોને ક્યાં ઉપચાર ઉપલબ્ધ છે તેની ચર્ચા કરો.
- પ્રશ્ન-૪ ડિરેક્ટરની વ્યાખ્યા આપો. તેનું કંપનીમાં કાયદુકીય સ્થાન શું છે તેની ચર્ચા કરો. (૧૪)  
 અથવા
- પ્રશ્ન-૪ કંપની વિસર્જનથી તમે શું સમજો છો. કંપની વિસર્જનની વિવિધ રીતોની ચર્ચા કરો.
- પ્રશ્ન-૫ સમજાવો ( ગમે તે બે ) (૧૪)
1. ડીવીડન્ડ અને તેની ચુકવણી.
  2. કંપનીની દીવાની અને ફોજદારી જવાબદારીઓ.
  3. સુત્રધારી કંપની અને સહાયક કંપની.
  4. અલ્પ શેર ધારકોની અધિકારોનું રક્ષણ.

**ENGLISH VERSION**

- Que-1 Define Company and explain the features of Company. (14)  
 OR
- Que-1 Discuss the different types of company.
- Que-2 What is Memorandum of Association? Explain the law relating to alteration of object clause. (14)  
 OR
- Que-2 Explain the procedure laid down under the Companies Act-2013 to alter the Article of Association of Company.
- Que-3 Who is a Promoter of a company? Discuss his legal position in relation to the company he promotes. (14)  
 OR
- Que-3 What is a Prospectus? What remedies are available to a share holder for mis-statement in a prospectus? Discuss.
- Que-4 Define Director. What is his legal position in a company? Discuss. (14)  
 OR
- Que-4 What do you understand by winding up of a company? What are the various modes of winding up? Discuss.
- Que-5 Explain (any two) (14)
1. Dividend and its payment
  2. Civil and criminal liability of a company.
  3. Holding and subsidiary company.
  4. Protection of rights of minority share holders.

\*\*\*\*\*